https://archive.org/details/bk697/page/n0/mode/1up

1956-10-22 -Odhavram Will -Kutchhi Lalram Ashram Haridwar (697)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ તથા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, હરિદ્વાર

સપ્ત સરોવર, હરિદ્વાર, યુ. પી. ૨૪૯૪૧૦.

પરમ પૂજ્ય બ્રહ્મલીન મહારાજશ્રી ઉધવરામજીનું વીલ.

હું કચ્છ ગામ વાંઢાય [ઈશ્વર નગર] નો સાધુ ઉધવદાસજી ગુરૂ લાલરામજી નીચે પ્રમાણે મારૂં છેલ્લું વીલ કરૂં છું.

મારી હરદ્વાર સપ્ત સરોવર ભુપતવાલા વાલી મિલક્ત બાબતમાં મેં મારા મૃત્યુ બાદ વ્યવસ્થા કરવા માટે એક લખાણ કરી તારીખ ૧૦-૧૦-૧૯૫૫ નાં રોજે હરદ્વારમાં રજીસ્ટર કરાવેલ છે. તે લખાણમાં મારા મૃત્યુ બાદ ટ્રસ્ટીઓ નીમેલા છે. પણ તેમાંના કેટલાક ગૃહસ્થોની જવાબદારી સ્વીકારવાની ઈચ્છા ન જોતાં અને કેટલાક મૃત્યુ પામતાં તે લખાણ રદ કરૂં છું. અને આ નવું લખાણ કરૂં છું.

— હાલે આ આશ્રમમાં નીચે પ્રમાણે મિલક્ત છે. —

૧) જોગીરાજ રામદયાલદાસજી ચેલા શ્રી ૧૦૮ યોગીરાજ ગુરુ ઊદાસજી પાસેથી તારીખ ૨૮-૪-૧૯૫૫ ના રોજ રૂપિયા ૧,૨૭૦-૦૦ માં લીધેલી તેના.

૨) જોગીરાજ રામદયાલદાસજી ચેલા શ્રી ૧૦૮ યોગીરાજ ગુરુ ઊદાસજી પાસેથી તારીખ ૯-૫-૧૯૫૫ ના રોજે રૂપિયા ૨,૫૦૦-૦૦ માં લીધેલી તેના.

૩) જમીનનો કટકો ૧ મોહનલાલ ઉધવદાસજીના નામે તારીખ ૧૫-૭-૧૯૫૫ ના રૂા. ૬૦) માં જોગીરાજ રામદયાલદાસજી પાસેથી બીનામી મારા માટે મારા પૈસાથી ખરીદેલ તે.

૪) જમીનનો કટકો ૧ મોહનલાલ ઉધવદાસજીના નામે તારીખ ૨૮-૧૧-૧૯૫૫ ના રૂા. ૮૦) માં શ્રી ગોવિન્દરામ શ્રી શીવરામ પુત્ર ગુરુ શ્રી સીસરામ પાસેથી ખરીદેલ છે અને જે બીનામી મારા માટે મારા પૈસાથી ખરીદેલ છે તે.

આ બધી સ્થાવર મિલક્તપર મકાનો ચણાવેલા છે તથા ચારે બાજૂ વંડી કરેલ છે. અને તેમાં હાલે સાધુઓને તથા ભજનાનંદી ભાઇ - બહેનોને આશ્રય મળે છે. તે શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ નામે ઓળખાય છે.

આ બધી સ્થાવર મિલકત તથા તે પરનાં મકાનો તથા તેનુ અંદરનું રાચરચીલું સાધનો, કુવા, બગીચા વિગેરે મેં જાતે દાને મેળવી બનાવેલ છે અને તે હાલે મારી સ્વપાર્જીત મિલકત છે. અને તેમાં કોઇનો પણ માલિક તરીકે સંબંધ નથી.

આ બધી મિલકતની મારા મરણબાદ નીચે પ્રમાણે વ્યવસ્થા કરવાની છે.

૧) આ આશ્રમ નિરંતર શ્રી લાલરામેશ્વર આશ્રમ તરીકે રહેશે.

૨) કચ્છના યાત્રાળુંઓના ઊતારા તરીકે રહેશે. અથવા સમયાનુસાર યોગ્ય લાગે તે વ્યવસ્થા કરવાના હક્કો અધિકાર સહીત મારા મરણબાદ નીચેના ભાઈઓને હું નીમું છું. તેમના નામ નીચે પ્રમાણે છે.

૧] શ્રી. શીવગણભાઇ રાજા - દેશલપર - ભુજ તાલુકો હાલે - મુંબઇ.
૨] શ્રી. હીરજી કરશન - માનકૂવા, ભુજ તાલુકો - હાલ વિષ્ણુપૂરા - ગુજરાત.
૩] શ્રી. દેવશી રામજી - વીરાણી - નખત્રાણા, હાલે - મોહનપર, તા. - મોડાસા.
૪] શ્રી. મુરજી જીવરાજ વીરાણી - નખત્રાણા હાલે - નવા નગર - ડેરોલ, તા - હિંમત નગર
૫] શ્રી. ડાહ્યાભાઇ હરીભાઈ - મથલ, તા. - નખત્રાણા, હાલે - મોજાસરી, તા. - પ્રાંતીજ.
૬] શ્રી. વાલજી કાનજી - લુડવા, તા. માંડવી, હાલ - રાયણ, તા. - મોડાસા, ગુજરાત.

realpatidar.com

https://archive.org/details/bk697/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk697/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.19 15:00:57 +05'30'

realpatidar.com

શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ તથા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, હરિદ્વાર

સપ્ત સરોવર, હરિદ્વાર, યુ. પી. ૨૪૯૪૧૦.

પરમ પૂજ્ય બ્રહ્મલીન મહારાજશ્રી ઉધવરામજીનું વીલ.

હું કચ્છ ગામ વાંઢાય [ઈશ્વર નગર] નો સાધુ ઉધવદાસજી ગુરૂ લાલરામજી નીચે પ્રમાણે મારૂં છેલ્લું વીલ કરૂં છું.

મારી હરદ્વાર સપ્ત સરોવર ભુપતવાલા વાલી મિલક્ત બાબતમાં મેં મારા મૃત્યુ બાદ વ્યવસ્થા કરવા માટે એક લખાણ કરી તારીખ ૧૦–૧૦–૧૯૫૫ નાં રોજે હરદ્વારમાં રજીસ્ટર કરાવેલ છે. તે લખાણમાં મારા મૃત્યુ બાદ ટ્રસ્ટીઓ નીમેલા છે. પણ તેમાંના કેટલાક ગૃહસ્થોની જવાબદારી સ્વીકારવાની ઈચ્છા ન જોતાં અને કેટલાક મૃત્યુ પામતાં તે લખાણ રદ કરૂં છું. અને આ નવું લખાણ કરૂં છું.

— હાલે આ આશ્રમમાં નીચે પ્રમાણે મિલક્ત છે. —

1) જોગીરાજ રામદયાલદાસજી ચેલા શ્રી ૧૦૮ યોગીરાજ ગુરુ ઊદાસજી પાસેથી તારીખ ૨૮–૪–૧૯૫૫ ના રોજ રૂપિયા ૧,૨૭૦–૦૦ માં લીધેલી તેના.

2) જોગીરાજ રામદયાલદાસજી ચેલા શ્રી ૧૦૮ યોગીરાજ ગુરુ ઊદાસજી પાસેથી તારીખ ૯–૫–૧૯૫૫ ના રોજે રૂપિયા ૨,૫૦૦–૦૦ માં લીધેલી તેના.

3) જમીનનો કટકો ૧ મોહનલાલ ઉધવદાસજીના નામે તારીખ ૧૫–૭–૧૯૫૫ ના રૂા. ૬૦) માં જોગીરાજ રામદયાલદાસજી પાસેથી બીનામી મારા માટે મારા પૈસાથી ખરીદેલ તે.

4) જમીનનો કટકો ૧ મોહનલાલ ઉધવદાસજીના નામે તારીખ ૨૮–૧૧-૧૯૫૫ ના રૂા. ૮૦૦) માં શ્રી ગોવિન્દરામ શ્રી શીવરામ પુત્ર ગુરુ શ્રી સીસરામ પાસેથી ખરીદેલ છે અને જે બીનામી મારા માટે મારા પૈસાથી ખરીદેલ છે તે.

આ બધી સ્થાવર મિલક્તપર મકાનો ચણાવેલા છે તથા ચારે બાજૂ વંડી કરેલ છે. અને તેમાં હાલે સાધુઓને તથા ભજનાનંદી ભાઈ – બહેનોને આશ્રય મળે છે. તે શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ નામે ઓળખાય છે.

આ બધી સ્થાવર મિલકત તથા તે પરનાં મકાનો તથા તેનુ અંદરનું રાચરચીલું સાધનો, કુવા, બગીચા વિગેરે મેં જાતે દાને મેળવી બનાવેલ છે અને તે હાલે મારી સ્વપાર્જીત મિલકત છે. અને તેમાં કોઇનો પણ માલિક તરીકે સંબંધ નથી.

આ બધી મિલકતની મારા મરણબાદ નીચે પ્રમાણે વ્યવસ્થા કરવાની છે.

1) આ આશ્રમ નિરંતર શ્રી લાલરામેશ્વર આશ્રમ તરીકે રહેશે.

2) કચ્છના યાત્રાળુંઓના ઊતારા તરીકે રહેશે. અથવા સમયાનુસાર યોગ્ય લાગે તે વ્યવસ્થા કરવાના હક્કો અધિકાર સહીત મારા મરણબાદ નીચેના ભાઈઓને હું નીમું છું. તેમના નામ નીચે પ્રમાણે છે.

૧] શ્રી. શીવગણભાઇ રાજા – દેશલપર – ભુજ તાલુકો હાલે – મુંબઇ.
૨] શ્રી. હીરજી કરશન – માનકૂવા, ભુજ તાલુકો – હાલ વિષ્ણુપૂરા – ગુજરાત.
૩] શ્રી. દેવશી રામજી – વીરાણી - નખત્રાણા, હાલે - મોહનપર, તા. - મોડાસા.
૪] શ્રી. મુરજી જીવરાજ વીરાણી – નખત્રાણા હાલે - નવા નગર – ડેરોલ, તા - હિંમત નગર
૫] શ્રી. ડાહ્યાભાઇ હરીભાઈ - મથલ, તા. - નખત્રાણા, હાલે - મોજાસરી, તા. - પ્રાંતીજ.
૬] શ્રી. વાલજી કાનજી – લુડવા, તા. માંડવી, હાલ - રાયણ, તા. - મોડાસા, ગુજરાત.

realpatidar.com

https://archive.org/details/bk697/page/n3/mode/1up

1956-10-22 -Odhavram Will -Kutchhi Lalram Ashram Haridwar (697)

realpatidar.com

સ્થાવર જંગમ મિલકતની ઉપર બતાવેલ હેતુઓસરની વ્યવસ્થા માટે માલિકી ઉપર બતાવેલા વ્યવસ્થાપકોની રહેશે. આમાંના કેટલાક ભાઇઓ હાલે બધો વહિવટ ચલાવે છે. અને દરેક પ્રકારનું આશ્રમનું કામકાજ પણ કરે છે.

આ વ્યવસ્થાપકો બહુમતીથી હોદ્દેદારો નીમશે અને તેમના પાસે હિસાબ કિતાબ રખાવશે. અને નવા વ્યવસ્થાપકોને દાખલ કરવા કે બદલવા કે સંખ્યા વધારવી તે તેમની બહુમતીની ઇચ્છાને આધિન રહેશે.

મારા કોઈપણ ચેલાની આ મિલકત પરત્વે કોઇપણ અધિકાર નથી અને રહેશે પણ નહીં.

— હાલે મારા પાવરદાર તરીકે મે નીચેના ભાઇઓ નિમ્યા છે. —

૧) શ્રી. શીવગણભાઇ રાજા અને અથવા ૨) હીરજી કરશન

હાલે પણ આશ્રમની વ્યવસ્થા ઉપર બતાવેલ ભાઈઓ કરે છે. અને તેમણે પોતાની મદદમાં બીજા ગૃહસ્થોને રાખેલ છે. અને ઉપર પ્રમાણે વ્યવસ્થા કરવા કેટલાક ભાઇઓએ કબૂલ કરેલ છે. તે બદલ તેમણે આ લખાણમાં મારી સહી વખતે હાજર રહી સાક્ષી કરેલ છે.

આ વીલ મેં શુદ્ધ બુદ્ધિથી અકકલ હોસિયારીથી મનચિત સાવચેતીમાં કરેલ છે.

આ લખાણ મારૂં છેલ્લું વીલ છે.

તારીખ ૨૨ ઓકટોબર સન ૧૯૫૬ — સહી : સાધુ ઉધવરામજી ગુરૂ લાલરામજી

સહી : ૬ : પોતાના

— સાક્ષીની સહીઓ —

૧.	રાઠોડ મનજી જેરામ	૮.	શાંતીદાસ ગુરુ દયાલદાસ
૨.	સાધુ દયાળદાસજી ગુરુ ઉધવદાસજી	૯.	જીવરાજ ખીમજી
૩.	શીવગણભાઇ વસ્તા	૧૦.	ભીમજી વસ્તા
૪.	હીરજીભાઇ કરસન	૧૧.	રતીલાલ વેલજી
૫.	દેવશીભાઇ રામજીભાઈ	૧૨.	સામજી કરસન
૬.	ડાહ્યાભાઈ હરીભાઈ પટેલ	૧૩.	મુળજીભાઇ જેરામ
૭.	વાલજી કાનજી	૧૪.	ખીમજી

ડ્રાફ્ટ ઉપરથી લખનાર ઠકકર સુરજી કુંવરજી વા૯

વીલ કરનાર ગામ વાંઢાય (ઇશ્વર નગર) ના સાધુ ઉધવદાસજી ગુરુ લાલરામજી ઉ. વ. ૭૨ ધંધો નિવૃત્તિને આ વીલ વાંચી સંભળાવતાં વીલ કરવાનું કબુલ કરે છે. તેમને એડવોકેટ શ્રી ગોપાળજી ઉ. ભણસાલી ઓળખે છે. તેમને સબ-રજીસ્ટ્રાર જાણે છે.

Sd. /- Sd. /-

ઉધવરામ સબ-રજીસ્ટ્રાર - ભુજ

હું ઉધવદાસજી ગુરૂ લાલરામજી ને ઓળખું છું.

Sd. /- વકીલ ગોપાલજી ઉમરશી

એડવોકેટ - કચ્છ કોર્ટસ

realpatidar.com